

જુવેનાઇલ જસ્ટીસ એક્ટઅન્વયે રાજ્યના ૨૬ જિલ્લામાં રચાયેલ જુવેનાઇલ જસ્ટીસ બોર્ડ  
(J.J.B.)ના બિનસરકારી સામાજિક કાર્યકરોની નિમણૂક કરવા બાબત.

રાજ્યનાં નવરચિત ૭ જિલ્લાઓ છોટાઉદેપુર, અરવલ્લી, મહીસાગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, મોરબી, બોટાદ સિવાયના તમામ ૨૬ જિલ્લાઓમાં જુવેનાઇલ જસ્ટીસ એક્ટ હેઠળ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકોના ન્યાય અને નિર્ણય માટે કાર્યરત રચાયેલ જુવેનાઇલ જસ્ટીસ બોર્ડમાં નીચે મુજબની લાયકાત ધરાવતાં બે બિનસરકારી સભ્યોની નિમણૂક માટે સામાજિક ક્ષેત્રે કાર્યરત ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવે છે. (ઉપરોક્ત બે જગ્યાઓ પૈકી એક જગ્યા મહિલા માટે અનામત છે.)

૧. તા.૧.૧.૨૦૧૬ ની સ્થિતિએ ૩૫ વર્ષ કે તેથી વધુ ઉંમર.
૨. બાળકોનાશિક્ષણ,આરોગ્ય અથવા કલ્યાણકારી પ્રવૃત્તિઓમાં લઘુત્તમ સાત વર્ષથી સક્રિય રીતે કાર્યરત.

અથવા

૩. બાળ મનોવિજ્ઞાન અથવા મનોચિકિત્સા અથવા સમાજકાર્ય અથવા સમાજશાસ્ત્ર અથવા માનવ વિકાસ ક્ષેત્રમાં અથવા કાયદાના ક્ષેત્રમાં પદવી ધરાવતા કાર્યરત વ્યવસાયી.

નોંધ : (૧)ઉપરોક્ત જાહેરાત સરકારી નોકરીની ભરતી માટેની નથી.

(૨)પસંદગી પામનાર વ્યક્તિને જુવેનાઇલ જસ્ટીસ બોર્ડ (J.J.B.) ની પ્રત્યેક બેઠકમાં હાજરી આપવા બદલ સરકારશ્રીના પ્રવર્તમાન નિયમોનુસાર મળવાપાત્ર ભથ્થા સિવાય અન્ય કોઇ પગાર ભથ્થા મળવાપાત્ર નથી.

(૩)બોર્ડમાં સભ્ય તરીકે નિયુક્ત થનાર વ્યક્તિની નિયુક્તિની મુદત મહત્તમ ત્રણ વર્ષની રહેશે.

(૪)જરૂર જણાય તો પસંદગી માટે બહુ વૈકલ્પિક પ્રશ્નો આધારીત પરીક્ષા, કોમ્પ્યુટર કૌશલ્ય પરીક્ષા તથા રૂબરૂ મુલાકાત માટે સ્વખર્ચે “રાજ્ય સ્તરની પસંદગી સમિતિ” સમક્ષ હાજર રહેવાનું રહેશે.

(૫)અરજી માટેની વિગતવાર વધુ સુચનાઓ તથા અરજીપત્રક સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની વેબસાઇટ <https://sje.gujarat.gov.in/dsd/> પરથી ડાઉનલોડ કરી, વાંચી, સમજી ત્યારબાદ અરજી કરવાની રહેશે.

(૬) વધુ માહિતી માટે કચેરીના ફોન નં ૦૭૯-૨૩૨૪૨૫૨૧ પર ૧૧: ૦૦ થી ૫:૦૦ દરમિયાન સંપર્ક કરવા વિનંતી.

(૭) અરજી તા.૩૦.૬.૨૦૧૬ સુધીમાં નીચે દર્શાવેલ સરનામે કક્ત રજી.એડીથી જ પહોંચતી કરવાની રહેશે.કચેરી ખાતે રૂબરૂ/કુરીયરથી અરજી સ્વીકારવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેશે.

(૮) લાયકાત, અનુભવના પ્રમાણપત્ર સાથે નિયતપત્રકમાં અરજી “મુખ્ય કારોબારી અધિકારી વ નિયામકશ્રી, ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી, બ્લોક નં.૧૯, ૩જો માળ, ડૉ.જીવરાજ મહેતા ભવન, સેક્ટર-૧૦, ગાંધીનગર” ને કરવાની રહેશે. સમય મર્યાદા બાદ આવેલ અરજી ધ્યાનમાં લેવાશે નહિ.

(૯) પસંદગી પામેલ વ્યક્તિએ નિમણૂંક પામતા પહેલા તાલીમ ફરજિયાત પૂર્ણ કરવાની રહેશે. જો તાલીમ પૂર્ણ નહીં કરે તો તેમની નિમણૂંક રદ કરવામાં આવશે.

## સભ્ય માટે લાયક ન હોય તેવી વ્યક્તિ:

(i) અગાઉ કોઇ પણ બાબતે દોષી ઠેરવાયેલ હોવા જોઇએ નહીં.

(ii) કોઇ અનૈતિક કૃત્ય અથવા હિંસા અથવા બાળકોના શોષણ સંબંધિત કૃત્યોમાં સામેલ હોવા જોઇએ નહીં.

(iii) પૂર્ણ કાલીન વ્યવસાયમાં જોડાયેલ રહેવાથી તે/તેણી કાયદા અને નિયમો મુજબ બોર્ડમાં કામ કરવા માટે જરૂરી સમય અને ધ્યાન આપી શકે નહીં.

(iv) બોર્ડના સભ્ય તેમના કાર્યકાળ દરમિયાન કોઇ બાળ સંભાળ સંસ્થા સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલ અથવા કોઇ સંઘર્ષ કે હિતના કારણે સંકળાયેલ હોવી જોઇએ નહીં.

(v) કોઈપણ રાજકીય પક્ષ સાથે જોડાયેલ હોવા જોઇએ નહીં.

(vi) નાદાર હોવા જોઇએ નહીં.

(vii) નૈતિક ભ્રષ્ટતાવાળા કોઇ પણ ગુનામાં દોષિત ઠેરવવામાં આવેલ હોય અને આવી શિક્ષા દૂર કરવામાં આવેલ ન હોય અથવા તેવા ગુનાના સંદર્ભમાં સંપૂર્ણ માફી આપવામાં ન આવેલ હોય